

06th July, 2020

To,
The Manager (Listing),
The BSE Limited
25th Floor, P.J. Towers, Dalal Street, Fort,
Mumbai-400001

Scrip Code: 530789

Sub: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015


Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith a copy of advertisement related to notice of updation of Email ID and Bank details and TDS on Dividend by the Company published in English and vernacular language newspapers on 05th July, 2020.

Thanking You,

Yours Faithfully,

For Ceejay Finance Limited



Shailesh Bharvad
Company Secretary & Compliance Officer

Encl: 1. Notice published in the Western Times, English dated 05th July, 2020
2. Notice published in the Western Times. Gujarati dated 05th July, 2020

Tesla to do cross-country drive with Cybertruck later this year: Musk

San Francisco, Tesla aims to do a cross-country drive with Cybertruck later this year to let people closely see the electric pickup truck, said Elon Musk.

A fan asked Tesla CEO when the East Coast of the US would get a glimpse of the futuristic EV pickup.

"Sure, we will aim to do a cross-country drive with Cybertruck later this year," Musk replied on Friday.

West Coast is Cybertruck's exclusive area. The truck was recently on display at the Petersen Automotive Museum in Los Angeles, California.

A cross-country road trip in a Cybertruck would undoubtedly generate an enormous amount of traction on all social platforms for the truck and the manufacturer.

Tesla is also reportedly planning to build its next Gigafactory factory to produce Cybertrucks near Austin, Texas.

As per reports, Musk is set on bringing the next Tesla Gigafactory, or 'Terafactory', to Austin, Texas, or at least close to the city.

The factory could produce Tesla's electric pickup truck as well as company's new Model Y crossover electric vehicle.

The Palo Alto-based company said it delivered 90,650 vehicles in the June quarter. It achieved the feat despite its Fremont, California based factory was out of action owing to Covid-19 lockdown for most part of the quarter.

Tesla delivered 80,050 Model 3s and Model Ys in the quarter and 10,600 of its Model S luxury sedan and Model X SUVs.

Intel to invest Rs 1,894 crore in Jio Platforms

New Delhi, Reliance Industries Limited (RIL) and Jio Platforms Limited on Friday announced that Intel Capital will invest Rs 1,894.50 crore in Jio Platforms at an equity value of Rs 4.91 lakh crore and an enterprise value of Rs 5.16 lakh crore.

Intel Capital's investment will translate into a 0.39 per cent equity stake in Jio Platforms on a fully diluted basis. Intel Capital joins the list of marquee firms who have recently invested in Jio Platforms, taking the total investment amount to Rs 1.17 lakh crore. Jio Platforms, a wholly-owned subsidiary of Reliance Industries, is a next-generation technology platform focused on providing high-quality and affordable digital services across India, with more than 388 million subscribers.

Mukesh Ambani, Chairman and Managing Director

of Reliance Industries, said, "We are extremely delighted to deepen our ties with technology leaders that embody our vision of transforming India into a leading Digital Society in the world. Intel is a true industry leader, working towards creating world-changing technology and innovations."

"Intel Capital has an outstanding record of being a valuable partner for leading technology companies globally. We are therefore excited to work together with Intel to advance India's capabilities in cutting-edge technologies that will emeconomy and improve the quality of life of 1.3 billion Indians," Ambani added.

Wendell Brooks, Intel Capital President, said, "Jio Platforms' focus on applying its impressive engineering capabilities to bring the power of low-cost digital services to India aligns with

Intel's purpose of delivering breakthrough technology that enriches lives. We believe digital access and data can transform business and society for the better. Through this investment, we are excited to help fuel digital transformation in India, where Intel maintains an important presence."

Jio Platforms has made significant investments across its digital ecosystem, powered by leading technologies spanning broadband connectivity, smart devices, cloud and edge computing, big data analytics, artificial intelligence, Internet of Things, augmented and mixed reality and blockchain.

Jio's vision is to enable a Digital India for 1.3 billion people and businesses across the country, including small merchants, micro-businesses and farmers so that all of them can enjoy the fruits of inclusive

growth. Intel Capital invests globally in innovative companies with a focus on disruptive technology areas like cloud computing, artificial intelligence and 5G A— opportunities where Jio is also innovating and investing for growth.

Intel Capital is the investment arm of Intel Corporation, a leader in the semiconductor industry, shaping the data-centric future with computing and communications technology that is the foundation of global innovations. Intel has operated in India for more than two decades and today employs thousands of employees there with state-of-the-art design facilities in Bengaluru and Hyderabad.

Morgan Stanley acted as financial advisor to Reliance Industries and AZB & Partners and Davis Polk & Wardwell acted as legal counsels.

Business Brief

Instagram to launch a huge redesign for Stories

San Francisco, Facebook-owned Instagram is preparing to launch a huge redesign that would make easier to watch favourite Stories in one place.

Julian Gamboa, Marketing and Social Media Manager at Adweek, recently posted screenshots of the new layout to Twitter and wrote: "You have heard of two rows of Instagram Stories...Now prepare for SEE ALL STORIES."

The screenshots indicate that the main feed may soon include two rows of Stories at the top of the screen.

Additionally, there will be a new 'See All Stories' bar at the top of the screen and once tapped, a user will be taken to a new tab in which all friends stories are laid out in a grid.

Instagram is also working on a new feature called video note for its standalone messaging app Threads that helps users stay connected to close or smaller circle of friends.

The new feature will automatically turn audio in videos to live captions. The video note feature would also help Threads users understand what their friends actually mean to say, and respond clearly.

Petrol, diesel prices unchanged for fifth day in a row

New Delhi, Fuel prices remained unchanged on Saturday making it the fifth consecutive day when pump prices of petrol and diesel have remained static.

Fuel prices have gone for a longer pause after rising on 22 of the past 28 days. The oil marketing companies (OMC) began their daily price revision system from June 7 that kept the petrol and diesel prices to rise continuously by an average 50-60 paise per day.

In the national capital, petrol price on Saturday stood at Rs 80.43 per litre and diesel at Rs 80.53 a litre, same level as the last four days when OMCs went for a pause and kept the prices unchanged.

Sources in public sector oil companies said consumers could get relief from the regular price rise of the two petroleum products in coming days as the pause for four days now could be replicated if global oil prices remained soft.

Also, the oil companies have covered most of the shortfall when for 82 continuous days (from March 14 to June 6) petrol and diesel prices remained unchanged while the government substantially raised taxes on the products.

But With global oil prices now again rising over \$42 a barrel, there could be instance that petrol and diesel prices may begin their daily rise again. But for this to happen, the current level of crude price has to rise further.

Liquidity to MSME rises as bank sanctions cross Rs 1.10L cr

New Delhi, The Central government is going all out to ensure that liquidity concerns of the MSME sector are addressed on priority under its Emergency Credit Line Guarantee Scheme (ECLGS).

As of July 1, 2020 public sector and private banks have sanctioned loans worth over Rs 1.10 lakh crore under the 100 per cent Emergency Credit Line Guarantee Scheme, of which more than Rs 52,000 crore has already been disbursed.

There has been a big jump in sanctions in the last couple of weeks. And just in the last six days up to July 1 sanctions have increased by a whopping Rs 10,000 crore while disbursement has increased by Rs 7,000 crore.

In a tweet, office of Finance Minister Nirmala Sitharaman said: "As of July 1, the total amount sanctioned under the 100 per cent Emergency Credit Line Guarantee Scheme by #PSBs and private banks stands at Rs 1,10,343.77 crore, of which Rs 52,255.53 crore has already been disbursed."

The ECLGS scheme is the biggest fiscal component of the Rs 20-lakh crore Self-Reliant India Mission package announced by Finance Minister Nirmala Sitharaman in May.

To ensure that the scheme achieves its objective of providing adequate liquidity to the MSME segment during the current difficult period, the finance ministry has regularly held meetings with the banks.

A finance ministry statement said that banks from both public and private sector have contributed to the success of the ECLGS. Of the Rs 52,000 crore disbursement, public sector banks have released Rs 33,000 crore to about 12,59,000 MSME accounts while private banks have disbursed Rs 19,000 crore to about 1,45,000 accounts.

iPhone may soon replace your passport, driver's license

San Francisco, After letting you open your car with a digital key, Apple is planning to upgrade iPhones with technology that would replace physical documents such as library cards, driver's licenses, passports and other documents used for verification.

There have been a series of various patent applications that have been submitted, all with the name 'Providing Verified Claims of User Identity', reports AppInsider.

All these patents describe a specific method on how the user could record and transmit their ID and have it confirmed, although Apple did not really mention the word iPhone even once. Instead, the company refers that it could be any piece of technology.

"A device implementing a system for using a verified claim of identity includes at least one processor configured to receive a verified claim including information to identify a user of a device," reads one such application. "The verified claim being signed by a server based on verification of the information by an identity verification provider separate from the server, the verified claim being specific to the device," the application said.

PUBG Mobile's lifetime revenue hits \$3bn, India tops download chart

New Delhi, Battle Royale title game PUBG Mobile has seen a global revenue gain of \$1.3 billion (roughly Rs 9,731 crore) in the first half of this year, bringing its lifetime collection to \$3 billion (nearly Rs 22,457 crore) with the highest number of downloads in India which ranks at the top with 175 million installs.

With people staying home owing to the Covid-19 pandemic and lockdowns, the PUBG revenues hit a record high of \$270 million (around Rs 2,021 crore) in March, reveals data from analytics firm Sensor Tower.

PUBG is not banned in India as it is not entirely Chinese. The game has been created and managed by Bluehole which is a South Korean organisation.

After PUBG became popular, Tencent — a Chinese conglomerate — joined hands with Bluehole to market the product in China and started handling a large portion of its distribution. The game is distributed in India by Tencent Holdings. The game did not feature in the banned list due to its mixed ownership, since it's not entirely Chinese.

30% individual super spreaders caused 80% Covid infections globally

San Francisco,

Nearly 80 per cent of the Covid-19 infections have been caused by the top 30 per cent most infectious people worldwide and there is a very wide range of infections that are still undetected, says Dr Lucy Li, a data scientist at the Chan Zuckerberg Biohub (CZB).

While there are still individual super-spreaders, perhaps more important for this current coronavirus pandemic is the contribution of super-spreading events where large numbers of people congregate in close proximity, she said during an interview with an Amazon team this week.

Her latest research to estimate unreported Covid-19 cases is supported by the AWS Diagnostic Develop-

ment Initiative, a global programme to support organisations working to bring better, more accurate, diagnostics solutions to market faster.

Biohub is a joint collaborative effort by UC Berkeley, University of California, San Francisco (UCSF) and Stanford University funded by a \$600 million commitment from Facebook CEO and founder Mark Zuckerberg and his wife Priscilla Chan.

According to Li, one thing that makes Covid-19 challenging to track is that not all individuals who have it exhibit symptoms.

"The virus genome mutates at a fairly constant rate as it spreads across the population, even when it's spreading in asymptomatic individuals. That means that

every time someone new is infected, the virus changes a little bit and that mutation happens at a fairly constant rate as it spreads," she explained.

So even if we aren't able to test everyone in the population, as long as we know how quickly the virus mutates, we can infer the likely number of undetected transmission events between people who were tested.

"For this research, I created a mathematical model to estimate the number of undetected infections at 12 locations in Asia, Europe, and the US over the course of the pandemic," she informed.

She found that there was a very wide range of infections that were undetected across these loca-

tions.

The rate of undetected infections was as high as over 90 per cent in Shanghai.

"We also found that there was significant change over time in the probability of detecting a case," said Li.

When the virus was first transmitted to these 12 locations, over 98 per cent of infections were undetected during those initial couple of weeks, indicating that the epidemic was already taking off by the time that intense testing started happening.

The overall number of global Covid-19 cases has surpassed the 11 million mark, while the deaths have soared to more than 5,24,000, according to Johns Hopkins University.

Apple survey prods iPhone users about power adapters' use

San Francisco,

Apple is surveying limited users on power adapters in its iPhone boxes, amid reports that the company would no longer include a power adapter in its iPhone 12 boxes later this year.

It appears Apple is surveying recent iPhone buyers to ask about what they've done with the power adapters that came with their previous iPhones.

Multiple users in Brazil have posted on Twitter about the survey that include questions about how they use the charger, including one specifically addressing the fate of the charger that was included with previous iPhone XR.

In another tweet, a Brazilian user said Apple asked about the charger that came with the user's previous iPhone 7 Plus.

Apple appears to be preparing its own 20-watt fast-charging adapter that would be sold as a separate accessory, an upgrade over the 18-watt adapter that currently ships in the box with the iPhone 11 Pro and iPad Pro and is also available on a standalone basis.

This is not the first time Apple has asked users what they think about its products.

The company once sent a questionnaire about headphone jack on MacBook Pro.

Apple's upcoming iPhone 12 Pro and iPhone 12 Pro Max will reportedly feature displays capable of up to 120Hz refresh rates.

Famed tipster Ice Universe, who has previously been proven right on leaks regarding Samsung, Xiaomi as well as Apple claimed that the two.1

EU regulators begin closer scrutiny of \$2.1bn Google-Fitbit deal

London,

After issuing a warning in February about potential privacy risks of Google having access to Fitbits data, the European Union (EU) regulators have now sent detailed questionnaires to their rivals, asking them to assess how the acquisition can affect the digital healthcare space.

The anti-competition watchdog has set a deadline of July 20 for its next decision regarding the \$2.1 billion Google-Fitbit deal.

"The level of detail in the recent questionnaires sent to the companies' rivals suggests an extended investigation could be in the works," reports The Financial Times.

The EU regulators have asked rivals whether the Google-Fitbit deal will disadvantage fitness tracking apps hosted in Google's Play Store, and "how Google might use the data to pro-

file users for its search and advertising business".

The move comes in the wake of the tech giant's plan to scoop up the health and activity data of millions of Fitbit users.

Regulators are in the process of considering whether to allow the tech giant to gobble up all this data.

In an earlier statement, the European Data Protection Board (EDPB) wrote: "There are concerns that the possible further combination and accumulation of sensitive

personal data regarding people in Europe by a major tech company could entail a high level of risk to the fundamental rights to privacy and to the protection of personal data."

In the EU, how privacy is handled will have a huge impact on whether or not the deal goes through.

The EDPB also left a re-

minder that Google and Fitbit are obligated to conduct a transparent assessment of "the data protection requirements and privacy implications" regarding this merger.

The US Justice Department and Australia's Competition and Consumer Commission have also raised their concerns over the deal.

"Buying Fitbit will allow Google to build an even more comprehensive set of user data, further cementing its position and raising barriers to entry to potential rivals," according to ACCC Chairman Rod Sims.

Google acquired Fitbit for \$2.1 billion late last year, a deal that includes the user data of Fitbit customers including activity, sleep, location, and other health data.

Google, however, has stressed that "Fitbit health and wellness data will not be used for Google ads."

US reports over 50,000 COVID-19 cases for 3rd consecutive day

Washington,

The US, which currently accounts for the highest number of coronavirus cases and deaths in the world, has registered more than 50,000 new infections for the third consecutive day amid a sudden surge in 40 out of the 50 states in the country.

According to the Johns Hopkins University, the US on Friday reported at least 51,842 new cases, taking the

overall number of infections 2,793,425, while the death toll stood at 129,432.

The current worst-hit states of California, Arizona, Texas and Florida all posted record new cases this week.

Florida reported nearly 9,500 additional coronavirus cases on Friday, while Texas registered 7,555 new infections.

Florida is averaging more new cases per day — 7,870 — than any other

state.

Nearly two dozen states have paused their reopenings to combat the virus spread while others have taken extra measures to keep it out of their borders, said a CNN report.

New York, New Jersey and Connecticut issued a travel advisory that requires people arriving from eight states with high coronavirus rates to quarantine for two weeks.

WESTERN RAILWAY-AHMEDABAD

VARIOUS CONSTRUCTION WORKS
E-Tender Notice No. EL/C/AD/235/2020-21 (1) Name of work with its location: Electrification of UTS/PRS building, Platforms, Cover Sheds, battery charging Facilities between Mahesana-Jugadun line in CRV utility shifting for the proposed DFC parallel alignment on Pansar-Palanpur section. (2) Approximate Cost of Work: ₹ 69,14,595/- (3) EMD: ₹ 1,38,300/- (4) Date and time of submission and opening of bid: As specified on IREPS portal. (5) Completion Period of work: 12 Months (6) Website particulars and Notice Board where details of tender can be seen and address of the Chief Engineer (Construction), Western Railway, Kalapur, Ahmedabad (Gujarat-380 002. Website: www.ireps.gov.in CPM-09)
Follow us on twitter.com/WesternRly

WESTERN TIMES Disclaimer

Advertisement appeared in this News Paper have not been verified factually and "WESTERN TIMES" does not stand responsible for the sales proposition.

BOARD MEETING

GUJARAT CRAFT INDUSTRIES LIMITED

This is to inform you that the Board of Directors of the Company will meet on 7th July, 2020 in which the Board of Directors will consider and approve Audited Financial Result for the financial year 2019-20 ended on 31st March, 2020.

Gujarat Water Supply and Sewerage Board Gandhinagar

TENDER NOTICE NO. 5 / 2020-21 (Deposit work)

Executive Engineer, P.H. Mechanical Dn., GWSSB, Haji Market, 1st Floor, Opp. Jilla Sevasadan-2, Tithal Road, Valsad-396001. Phone NO. 99784 41274 invites on-line tenders for Construction of Mini Pipe WSS and M&R of Scheme for 5 Years for Taluka Dharampur, Kaprada Taluka Dist: Valsad from those who are registered in appropriate class and having work experience for tender ID No. 414255 with Estt. cost of Rs.33.39 Lakhs. The interested contractors shall have to pay required tender fee/EMD in prescribed manners/. Further details can be made available on web site www.nprocure.com & www.gwssb.nprocure.com & www.statetenders.com. Further any amendment made will be disburse only on above web site only. The last date of tender downloading/ uploading is Dtd. 27.07.2020 up to 18.00 hrs.

TOLL FREE NO. 1916

For rural level water supply scheme, 24 hours control room activate at state level, where, for complain/ suggestion toll free No. 1916 can be contacted. Water Supply & Sewerage Board. Gujarat Government

No.INF/Valsad/173/20

CEEJAY FINANCE LIMITED


(CIN:L65910G1993PLC019090)
Regd. Office: "CEEJAY HOUSE", Mota Pore, Nadiad-387001, Gujarat
Phone: 02682562633-34, Fax: 02682561727
Website: www.cejayfinancelimited.com, E-Mail: shaileshbharvad@cejaygroup.com

NOTICE FOR THE ATTENTION OF SHAREHOLDERS

Update of Email ID and Bank details:
Pursuant to the General Circular No. 20/2020 dated 5th May, 2020, issued by the Ministry of Corporate Affairs, the Company will send the annual report(s), notice(s) and other communications/benefits only through electronic mode to those shareholders whose e-mail addresses are registered with the Company/Depositories. The shareholders who have not yet registered their email address or bank account details, are requested to register the same in respect of shares held in demat form with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by visiting on the website of Company's Registrar & Transfer Agent, M/s. Link Intime India Private Limited ('Link Intime') at https://linkintime.co.in/EmailReg/Email_Register.html and upload the documents required therein.

TDS on Dividend:
In accordance with the prevailing provisions of the Income Tax Act, 1961, the Company would be required to deduct tax at source (TDS) at the prescribed rates on the dividend paid to its shareholders. The TDS rate would vary depending on the residential status of the shareholder and the documents submitted by them and accepted by the Company. Therefore, the members are requested to update their PAN to avoid deduction of tax at higher rate with the Depository participant for the shares held in demat form and with Link Intime for physical holding of shares at <https://linkintime.co.in/formsreg/submitform-15g-15h.html> and upload the documents required therein i.e. 15G / 15H/ 10F as the case may be, if applicable.

For, Ceejay Finance Limited
Place : Nadiad
Date : 4th July, 2020
Shailesh Bhavard
Company Secretary

 <p>GUJARAT WATER INFRASTRUCTURE LIMITED Dr Jivraj Mehta Bhavan, Block No. 1, First Floor, Sector 10 A Gandhinagar Mo- No. 9978441147-48 Fax No. (079) 23222396 Email- gwilcompany1@gmail.com</p>			
Tender Notice No. - 17/2020			
Chief General Manager (P), GWIL, Gandhinagar invites on-line tender for Comprehensive Operation, Maintenance and repairs of works for five years including pipeline & civil works for NC-09 Project & for Construction of RCC Sump Wall and CC work at Dhanki H.W. under NC 32 Project O & M as given below works.			
Sr. No.	Tender ID	Particulars	EMD Rs. Fee
1	415321	Comprehensive Operation, Maintenance & Repair of NC-9 Project including all Civil works (except pump house and sump), 1800/1350 dia. M.S. Pipeline from Maliya to Bhachau (56KM) Proper supply of water from Maliya to Bhachau, Maintenance of records etc. for 80 months. (3rd Attempt)	3,600/- 1,17,000/-
2	415317	Construction of RCC Sump Wall and CC work at Dhanki H.W. under NC 32 Project O & M (2nd Attempt)	900/- 11,000/-
<ul style="list-style-type: none"> Bid documents downloading start : 03.07.2020, 18.00 Hrs. Last date & time for on-line receipt of bids : 24.07.2020 up to 18.00 Hrs. Last date & time for physical submission of tender : 28.07.2020 up to 15.00 Hrs. Tender Opening : 28.07.2020, 17.00 Hrs. Further information is available on site http://gwil.nprocure.com. All documents like Tender Notice, Tender documents, Amendment and any changes will be put on web site. 			
INF/400/20-21			

